



લોન અરજી ફોર્મ (વાહન)

કૃપા કરીને ફોર્મને સુવાચ્ય અક્ષરોમાં અને ફક્ત કાળી શાહીથી જ ભરો

તારીખ

વાહન

☐ ઓટો☐ કોમર્શિયલ વાહન☐ ટ્રુ-વ્હીલર☐ ટ્રેક્ટર☐ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ

સુવિધાનો પ્રકાર	રકમ (રૂપિયામાં)	મુદત (મહિનાઓ)	કોલાટરલ/સિક્યોરિટી આપવામાં આવી છે (હા/ના)	સુવિધાનો પ્રકાર	રકમ (રૂપિયામાં)	મુદત (મહિનાઓ)	કોલાટરલ/સિક્યોરિટી આપવામાં આવી છે (હા/ના)
નવું				જૂનું			
વાહન દ્વારા સિક્યોર થયેલ લોન							
કૃષિ ટર્મ લોન				અંગત ટર્મ લોન			
વ્યાપાર ટર્મ લોન							

એ. અરજદારની વિગતો (બે શબ્દો વચ્ચે જગ્યા છોડો)

વર્તમાન ગ્રાહક☐ નવા ગ્રાહક☐ જો ચાલુ ગ્રાહક હોય તો કસ્ટમર આઈડી

સીકેવાયસીઆર નં.

☐ મારા/અમારા કેવાયસીમાં ફેરફાર(વિગતો/દસ્તાવેજ જમા કરો)

☐ મારા/અમારા કેવાયસીમાં કોઈ ફેરફાર નથી/રી-કેવાયસી બાકી નથી અને કેવાયસી જે તે તારીખથી માન્ય છે

બંધારણ☐ વ્યક્તિગત☐ માલિકી☐ ભાગીદારી પેઢી☐ પ્રાઈવેટ લિમિટેડ☐ પબ્લિક લિ.☐ સોસાયટી☐ ટ્રસ્ટ☐ અન્ય

નામ

પિતાનું નામ

અથવા

જીવનસાથીનું નામ

માતાનું નામ

મોબાઈલ નંબર +91

ટેલીફોન નં. (ઘર)

ટેલીફોન નં. (ઓફિસ)

ઈ-મેઇલ આઇડી

ધર્મ

હિંદુ

ખ્રિસ્તી

મુસ્લિમ

શીખ

બૌદ્ધ

જૈન

અન્ય

વર્ગ

સામાન્ય

અનુસૂચિત જાતિ

અનુસૂચિત જનજાતિ

ઓબીસી

અન્ય

વૈવાહિક સ્થિતિ

એકલા

પરીણિત

ફૂટેડ

વિધુર

વિચ્છેદ

રાષ્ટ્રીયતા/જન્મભૂમિ

ભારતીય

અન્ય

જન્મ/સંસ્થાપનનું સ્થળ

બિઝનેસ શરૂ થવાની તારીખ

પાન નંબર

ફોર્મ 60

(જો પાન માટે અરજી કરી હોય તો, કૃપા કરીને ફોર્મ 49એ પૂરું પાડો)

રહેણાંક સ્થિતિ

નિવાસી

બિનનિવાસી

ઓસીઆઈ/પીઆઈઓ

વિદેશી નાગરિક

જીએસટી નં.

ઉદયમ નંબર

નાગરિકતા

શું તમે રાજકીય રીતે સક્રિય વ્યક્તિ છો કે તેમની સાથે સંકળાયેલા છો?

હા

ના

શું તમે શારીરિક ખોડખાંપણ ધરાવો છો?

હા

ના

જો હા તો, બિમાર/વૃદ્ધ/અસક્ષમ

અંધ/દ્રષ્ટિમાં ક્ષતિ

અન્ય

શૈક્ષણિક લાયકાત

અશિક્ષિત

10માં ધોરણથી નીચે

મેટ્રિક (10મું ધોરણ)

ઈન્ટરમીડિએટ (12મું)

સ્નાતક

અનુસ્નાતક અને તેથી વધુ

અન્ય

શું તમે ભારત સિવાયના અન્ય કોઈ દેશના કર નિવાસી છો?

ના

હા

(જો હા, તો કૃપા કરીને એફએટીસીએ/સીઆરએસ ડિક્લેરેશન ફોર્મ અલગથી ભરો)

જીએસટી હેઠળ વ્યાખ્યાયિત કરવામાં આવ્યાં મુજબ, શું તમે એચુ સ્મોલ ફાયનાન્સ બેંક સાથે સંબંધિત છો**

હા

ના

*શું તમે આ ખાતાને આધારની સાથે જોડવા માંગો છો

હા

ના

સરનામાની લાઇન 1

સીમાચિહ્ન

જીલ્લો

રાજ્ય

પિન કોડ

દેશ

ભારત

અન્ય

વર્તમાન શહેરમાં સ્થાયી થયાના વર્ષ

વર્તમાન સરનામે સ્થાયી થયાના વર્ષ

મિલકતની સ્થિતિ

સ્વ-માલિકી

ભાડાની

કંપની દ્વારા આપવામાં આવેલ

પૈતૃક

અન્ય

સરનામાની લાઇન 2

સીમાચિહ્ન

જીલ્લો

રાજ્ય

પિન કોડ

દેશ

ભારત

અન્ય

મિલકતની સ્થિતિ

સ્વ-માલિકી

ભાડાની

કંપની દ્વારા આપવામાં આવેલ

પૈતૃક

અન્ય

કેવાયસી વિગતો

ઓળખનો પુરાવો☐ પાસપોર્ટ☐ ડ્રાઇવિંગ લાઇસન્સ☐ આધાર☐ મતદાર ઓળખ કાર્ડ☐ અન્ય

ઓળખ નંબર

સમાપ્તિ તારીખ

(જો લાગુ થતું હોય તો)

સરનામાનો પુરાવો☐ પાસપોર્ટ☐ ડ્રાઇવિંગ લાઇસન્સ☐ આધાર☐ મતદાર ઓળખ કાર્ડ☐ અન્ય

વ્યવસાય

પગારદાર

☐ સરકારી

☐ ખાનગી

☐ જાહેર ક્ષેત્ર

☐ સ્વ-રોજગાર કૃષિ

☐ સ્વ-રોજગાર ધરાવતા વ્યવસાયિક

☐ નિવૃત્ત

☐ વિદ્યાર્થી

☐ ગૃહિણી

☐ અન્ય

કુલ વાર્ષિક આવક (રૂ.)

1-250000

250001-500000

500001-1000000

1000001-2000000

2000001-2500000

2500001-5000000

5000001-10000000

>1 કરોડ

નિયોક્તા/વ્યવસાયની વિગતો

એકમ/નિયોક્તાનું નામ

કુલ અનુભવ નોકરી /વ્યવસાયમાં

વર્ષો

મહિના

વ્યવસાયનો પ્રકાર

ઉત્પાદક

સર્વિસ પ્રોવાઇડર

વેપારી/ફકાનદાર

ખેતી(કૃષિ) અને સહાયક પ્રવૃત્તિઓ

અન્ય

વ્યાપારનો પ્રકાર

1.

2.

વ્યાપારની સંરચના

માલિકી

ભાગીદારી પેઢી

પ્રાઈવેટ લિમિટેડ

અન્ય

એકમનો પુરાવો

એકમનો પુરાવો

વ્યવસાયનું સ્થાન

સ્વ-માલિકીનું (મોર્ગેજ કરેલ નિઃશુલ્ક)

ભાડાનું

પૈતૃક

અન્ય

સરનામાની લાઇન 1

સરનામાની લાઇન 2

શહેર

જિલ્લો

પિન કોડ

સીમાચિહ્ન

રાજ્ય

દેશ

ભારત

અન્ય

લાભાર્થી માલિક/અધિકૃત હસ્તાક્ષરકર્તાનું નામ અને વિગતો

નામ	વય	લિંગ	હોલો	હિસ્સો (%)માં	સંપર્ક:	ઓળખનો પુરાવો

તમારો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો કલર ફોટોગ્રાફ અહીં ચોટાડો અને તેની ઉપર સહી કરો

ફોટોગ્રાફ ઉપર પિન, ટેપ, સ્ટેપલનો ઉપયોગ કરવો નહીં

અરજદારની સહી

બી. સહ-અરજદારની વિગતો (બે શબ્દો વચ્ચે જગ્યા છોડો)

વર્તમાન ગ્રાહક

નવા ગ્રાહક

જો ચાલુ ગ્રાહક હોય તો કસ્ટમર આઈડી

સીકેવાયસીઆર નં.

મારા/અમારા કેવાયસીમાં ફેરફાર(વિગતો/દસ્તાવેજ જમા કરો)

મારા/અમારા કેવાયસીમાં કોઈ ફેરફાર નથી/રી-કેવાયસી બાકી નથી અને કેવાયસી જે તે તારીખથી માન્ય છે

બંધારણ

વ્યક્તિગત

માલિકી

ભાગીદારી પેઢી

પ્રાઇવેટ લિમિટેડ

પબ્લિક લિ.

સોસાયટી

ટ્રસ્ટ

અન્ય

નામ

પિતાનું નામ

અથવા

જીવનસાથીનું નામ

માતાનું નામ

મોબાઇલ નંબર +91

ટેલીફોન નં. (ઘર)

ટેલીફોન નં. (ઓફિસ)

ઈ-મેઇલ આઇડી

ધર્મ

હિંદુ

ખ્રિસ્તી

મુસ્લિમ

શીખ

બૌદ્ધ

જૈન

અન્ય

લિંગ

પ્રરૂપ

સ્ત્રી

ટ્રાન્સજેન્ડર

અન્ય

ત્રીજું લિંગ

વર્ગ

સામાન્ય

અનુસૂચિત જાતિ

અનુસૂચિત જનજાતિ

ઓબીસી

અન્ય

વૈવાહિક સ્થિતિ

એકલા

પરીણિત

છૂટાછેડા

વિધુર

વિચ્છેદ

રાષ્ટ્રીયતા/જન્મભૂમિ

ભારતીય

અન્ય

જન્મ/સંસ્થાપનની તારીખ

D

D

M

M

Y

Y

Y

Y

પાન નંબર

ફોર્મ 60

(જો પાન માટે અરજી કરી હોય તો, કૃપા કરીને ફોર્મ 49એ પૂરું પાડો)

રહેણાંક સ્થિતિ

નિવાસી

બિનનિવાસી

ઓસીઆઈ/પીઆઈઓ

વિદેશી નાગરિક

જીએસટી નં.

ઉદયમ નંબર

નાગરિકતા

શું તમે રાજકીય રીતે સક્રિય વ્યક્તિ છો કે તેમની સાથે સંકળાયેલા છો?

હા

ના

શું તમે શારીરિક ખોડખાંપણ ધરાવો છો?

હા

ના

જો હા તો,

બિમાર/વૃદ્ધ/અસક્ષમ

અંધ/દ્રષ્ટિમાં ક્ષતિ

અન્ય

નિ ય ત ક રો

શૈક્ષણિક લાયકાત

અશિક્ષિત

10માં ધોરણથી નીચે

મેટ્રિક (10મું ધોરણ)

ઈન્ટરમીડિએટ (12મું)

સ્નાતક

અનુસ્નાતક અને તેથી વધુ

અન્ય

નિ ય ત ક રો

શું તમે ભારત સિવાયના અન્ય કોઈ દેશના કર નિવાસી છો?

ના

હા

(જો હા, તો કૃપા કરીને એફએટીસીએ/સીઆરએસ ડીક્લેરેશન ફોર્મ અલગથી ભરો)

અરજદાર સાથે સંબંધ

જન્મ/સંરચનાનું સ્થળ

સરનામાની લાઇન 1

સરનામાની લાઇન 2

સીમાચિહ્ન

જીલ્લો

દેશ

ભારત

અન્ય

વર્તમાન શહેરમાં સ્થાયી થયાના વર્ષ

વર્તમાન સરનામે સ્થાયી થયાના વર્ષ

મિલકતની સ્થિતિ

સ્વ-માલિકી

ભાડાની

કંપની દ્વારા આપવામાં આવેલ

પૈતૃક

અન્ય

સરનામાની લાઇન 1

સીમાચિહ્ન

જીલ્લો

દેશ

ભારત

અન્ય

મિલકતની સ્થિતિ

સ્વ-માલિકી

ભાડાની

કંપની દ્વારા આપવામાં આવેલ

પૈતૃક

અન્ય

કેવાયસી વિગતો

ઓળખનો પુરાવો

પાસપોર્ટ

ડ્રાઇવિંગ લાઇસન્સ

આધાર

મતદાર ઓળખ કાર્ડ

અન્ય

ઓળખ નંબર

સમાપ્તિ તારીખ

(જો લાગુ થતું હોય તો)

સરનામાનો પુરાવો

પાસપોર્ટ

ડ્રાઇવિંગ લાઇસન્સ

આધાર

મતદાર ઓળખ કાર્ડ

અન્ય

વ્યવસાય

પગારદાર

સરકારી માનગી જાહેર ક્ષેત્ર

સ્વ-રોજગાર કૃષિ

સ્વ-રોજગાર ધરાવતા વ્યવસાયિક

નિવૃત્ત

વિદ્યાર્થી

ગૃહિણી

અન્ય

કુલ વાર્ષિક આવક (રૂ.)

1-250000

250001-500000

500001-1000000

1000001-2000000

2000001-2500000

2500001-5000000

5000001-10000000

>1 કરોડ

વિદેશી ચલણ ખુલાસો

હા

ના

નિયોક્તા/વ્યવસાયની વિગતો

એકમ/નિયોક્તાનું નામ

કુલ અનુભવ નોકરી /વ્યવસાયમાં

વર્ષો

મહિના

વ્યવસાયનો પ્રકાર

ઉત્પાદક

સર્વિસ પ્રોવાઇડર

વેપારી/કુકાનદાર

ખેતી(કૃષિ) અને સહાયક પ્રવૃત્તિઓ

અન્ય

વ્યાપારનો પ્રકાર

1.

2.

વ્યાપારની સંરચના

માલિકી

ભાગીદારી પેઢી

પ્રાઇવેટ લિમિટેડ

અન્ય

એકમનો પુરાવો

વ્યવસાયનું સ્થાન

સ્વ-માલિકીનું (મોર્ગેજ કરેલ નિ:શૂલ્ક)

ભાડાનું

પૈતૃક

અન્ય

સરનામાની લાઇન 1

સરનામાની લાઇન 2

શહેર

જિલ્લો

પિન કોડ

સીમાચિહ્ન

રાજ્ય

દેશ

ભારત

અન્ય

લાભાર્થી માલિક/અધિકૃત હસ્તાક્ષરકર્તાનું નામ અને વિગતો

નામ	વય	લિંગ	હોદ્દો	હિસ્સો (%માં)	સંપર્ક:	ઓળખનો પુરાવો

સી. પરીચિત વ્યક્તિની વિગત

નામ

મોબાઇલ નંબર

9

1

અરજદાર સાથે સંબંધ

પરિચિતતાના વર્ષો

નામ

મોબાઇલ નંબર

9

1

અરજદાર સાથે સંબંધ

પરિચિતતાના વર્ષો

ડી. પ્રાયોરિટી(પ્રાધાન્યતા) ક્ષેત્રનો વર્ગ

ખેતી ધિરાણ : દા.ત. ખેતી અને ડેરી, મત્સ્યઉદ્યોગ, પશુપાલન, મરઘાઉછેર, મધમાખી ઉછેર, રેશમઉદ્યોગ જેવી સંબંધિત પ્રવૃત્તિઓમાં સીધા જ સંકળાયેલ વ્યક્તિગત ખેડૂતો.

જમીન (એકર)

0-2.47

2.48-4.94

4.95 અને વધુ

નિયત કરો (એકર):

સ્થળ:

પિન:

કૃષિ માળખું: કૃષિ ઉપજ/ઉત્પાદનના સંગ્રહ માટે ઘડવામાં આવેલ કોલ્ડ-સ્ટોરેજ સહિત સંગ્રહ સુવિધા(વેરક્ષાઉસ, માર્કેટ યાર્ડ, ગોડાઉન અને કોઠાર)ના નિર્માણ માટે લોન

આનુષંગિક પ્રવૃત્તિઓ: ખાદ્ય અને કૃષિ પ્રોસેસિંગ

ઉત્પાદન કે સર્વિસ એન્ટરપ્રાઇઝ:

પી એન્ડ એમમાં અથવા ઉપકરણમાં રોકાણ:

રૂા. ૧ કરોડ સુધી

> રૂા. ૧ કરોડથી રૂા. ૧૦ કરોડ

> રૂા. ૧૦ કરોડથી રૂા. ૫૦ કરોડ

> ૫૦ કરોડ.

રોકાણનું મૂલ્ય (ડબલ્યૂડીવી) :

વાર્ષિક ટર્નઓવર:

રૂા. ૫ કરોડ સુધી

> રૂા. ૫ કરોડથી રૂા. ૫૦ કરોડ

> રૂા. ૫૦ કરોડથી રૂા. ૨૫૦ કરોડ

> ૨૫૦ કરોડ.

વાર્ષિક ટર્નઓવર () :

(વ્યવસાયિક/બિન-વ્યવસાયિક /એસઆરટીઓ/વેપાર/છૂટક વેપાર)

ખાદી અને ગ્રામોદ્યોગ (કેવીઆઈ ક્ષેત્ર)

ઘોષણા : મારા/અમારા દ્વારા આ સાથે ઘોષણા/પુષ્ટિ કરવામાં આવે છે કે મારા/અમારા દ્વારા ખરીદેલ/ખરીદવામાં આવનાર વાહન /લેવાયેલ લોન/લેવામાં આવનાર લોન આ હેતુસર ઉપયોગમાં લેવામાં આવશે

કૃષિના હેતુ અને/અથવા વ્યવની કૃષિ ઉપજ, કૃષિ ઉત્પાદન અને ખેત ઉત્પાદનના પરિવહનમાં સહાયના હેતુસર

વ્યવસાયના હેતુસર: હું/અમે જાણું છું/જાણીએ છીએ કે આ રજૂઆત, ઘોષણા અને મંજૂરી પર વિશ્વાસ રાખીને, પ્રાયોરિટી સેક્ટર એડવાન્સીઝ વર્ગ અંતર્ગત નાણાકીય સહાય માટેની મારી લોન અરજીને ધ્યાનમાં લેવાની તમે મંજૂરી આપી છે. મારા/અમારા દ્વારા ખોટી/અસત્ય ઘોષણાના કારણે થયેલ કોઈપણ નુકસાન કે ક્ષતિની ધટનામાં નુકસાનને સરભર કરવા માટે મારા/અમારા દ્વારા બેંકને ભરપાઈ કરવામાં આવશે.

ઈ. ગેરંટરની વિગતો (બે શબ્દો વચ્ચે જગ્યા છોડો)

વર્તમાન ગ્રાહક

નવા ગ્રાહક

જો ચાલુ ગ્રાહક હોય તો કસ્ટમર આઈડી

સીકેવાયસીઆર નં.

મારા/અમારા કેવાયસીમાં ફેરફાર(વિગતો/દસ્તાવેજ જમા કરો)

મારા/અમારા કેવાયસીમાં કોઈ ફેરફાર નથી/રી-કેવાયસી બાકી નથી અને કેવાયસી જે તે તારીખથી માન્ય છે

બંધારણ

વ્યક્તિગત

માલિકી

ભાગીદારી પેઢી

પ્રાઈવેટ લિમિટેડ

પબ્લિક લિ.

સોસાયટી

ટ્રસ્ટ

અન્ય

નામ

પિતાનું નામ

અથવા

જીવનસાથીનું નામ

માતાનું નામ

મોબાઈલ નંબર +91

ટેલીફોન નં. (ઘર)

ટેલીફોન નં. (ઓફિસ)

ઈ-મેઇલ આઇડી

ધર્મ

હિંદુ

ખ્રિસ્તી

મુસ્લિમ

શીખ

બૌદ્ધ

જૈન

અન્ય

લિંગ

પુરૂષ

સ્ત્રી

ટ્રાન્સજેન્ડર

^

^

ત્રીજું લિંગ

વર્ગ

સામાન્ય

અનુસૂચિત જાતિ

અનુસૂચિત જનજાતિ

ઓબીસી

અન્ય

જન્મ/સંસ્થાપનની તારીખ

D

D

M

M

Y

Y

Y

Y

વૈવાહિક સ્થિતિ

એકલા

પરીણિત

છૂટાછેડા

વિધુર

વિચ્છેદ

રાષ્ટ્રીયતા/જન્મભૂમિ

ભારતીય

અન્ય

તાંત્રિક સ્થિતિ

નિવાસી

બિનનિવાસી

ઓસીઆઈ/પીઆઈઓ

વિદેશી નાગરિક

પાન નંબર

ફોર્મ 60

(જો પાન માટે અરજી કરી હોય તો, કૃપા કરીને ફોર્મ 49એ પૂરું પાડો)

રહેણાંક સ્થિતિ

નિવાસી

બિનનિવાસી

ઓસીઆઈ/પીઆઈઓ

વિદેશી નાગરિકતા

જીએસટી નં.

શું તમે શારીરિક ખોડખાં પણ ધરાવો છો?

હા

ના

જો હા તો, બિમાર/વૃદ્ધ/અસક્ષમ

અંધ/દ્રષ્ટિમાં ક્ષતિ

અન્ય

શૈક્ષણિક લાયકાત

અશિક્ષિત

10માં ધોરણથી નીચે

મેટ્રિક (10મું ધોરણ)

ઈન્ટરમીડિએટ (12મું)

સ્નાતક

અનુસ્નાતક અને તેથી વધુ

અન્ય

નિ ય ત ક રો

શું તમે ભારત સિવાયના અન્ય કોઈ દેશના કર નિવાસી છો?

ના

હા

(જો હા, તો કૃપા કરીને એફએટીસીએ/સીઆરએસ ડીક્લેરેશન ફોર્મ અલગથી ભરો)

અરજદાર સાથે સંબંધ

જન્મ/સંરચનાનું સ્થળ

બિઝનેસ શરૂ થવાની તારીખ

સરનામાની લાઇન 1

સરનામાની લાઇન 2

સીમાચિહ્ન

જિલ્લો

રાજ્ય

પિન કોડ

દેશ

ભારતીય

અન્ય

વર્તમાન શહેરમાં સ્થાયી થયાના વર્ષ

વર્તમાન સરનામે સ્થાયી થયાના વર્ષ

મિલકતની સ્થિતિ

સ્વ-માલિકી

ભાડાની

કંપની દ્વારા આપવામાં આવેલ

પૈતૃક

અન્ય

સરનામાની લાઇન 2

સીમાચિહ્ન

જિલ્લો

રાજ્ય

પિન કોડ

દેશ

ભારત

અન્ય

મિલકતની સ્થિતિ

સ્વ-માલિકી

ભાડાની

કંપની દ્વારા આપવામાં આવેલ

પૈતૃક

અન્ય

કેવાયસી વિગતો

ઓળખનો પુરાવો

પાસપોર્ટ

ડ્રાઇવિંગ લાઇસન્સ

આધાર

મતદાર ઓળખ કાર્ડ

અન્ય

સરનામાનો પુરાવો

પાસપોર્ટ

ડ્રાઇવિંગ લાઇસન્સ

આધાર

મતદાર ઓળખ કાર્ડ

અન્ય

સમાપ્તિ તારીખ

(જો લાગુ થતું હોય તો)

વ્યવસાય

પગારદાર

સરકારી

ખાનગી

જાહેર ક્ષેત્ર

સ્વ-રોજગાર કૃષિ

સ્વ-રોજગાર ધરાવતા વ્યવસાયિક

કૃષિ

નિવૃત્ત

વિદ્યાર્થી

ગૃહિણી

અન્ય

કુલ વાર્ષિક આવક (રૂ.)

1-250000

250001-500000

500001-1000000

1000001-2000000

2000001-2500000

2500001-5000000

5000001-10000000

>1 કરોડ

વિદેશી ચલણ ખુલાસો

હા

ના

નિયોક્તા/વ્યવસાયની વિગતો

એકમ/નિયોક્તાનું નામ

કુલ અનુભવ નોકરી /વ્યવસાયમાં

વર્ષો

મહિના

વ્યવસાયનો પ્રકાર

ઉત્પાદક

સર્વિસ પ્રોવાઈડર

વેપારી/દુકાનદાર

ખેતી(કૃષિ) અને સહાયક પ્રવૃત્તિઓ

અન્ય

વ્યાપારની સંરચના

1.

2.

વ્યાપારની સંરચના

માલિકી

ભાગીદારી પેઢી

પ્રાઈવેટ લિમિટેડ

અન્ય

એકમનો પુરાવો {

વ્યવસાયનું સ્થાન

સ્વ-માલિકીનું

(મોર્ગેજ કરેલ નિ:શૂલ્ક)

ભાડાનું

પૈતૃક

અન્ય

સરનામાની લાઇન 1

સરનામાની લાઇન 2

શહેર

જિલ્લો

પિન કોડ

સીમાચિહ્ન

રાજ્ય

દેશ

ભારત

અન્ય

એફ. લોનના હેતુ માટેની ઘોષણા

અરજી કરવામાં આવેલ સુવિધાનો નીચેના હેતુસર ઉપયોગ કરવામાં આવશે (જ્યાં પણ લાગુપાત્ર હોય ત્યાં ટીક કરો)

લોનનો હેતુ

વ્યવસાય

આવશ્યક રકમ

લોનનો હેતુ

વ્યવસાય

આવશ્યક રકમ

કાર્યક્રમી ભંડોળ

સ્ટોકની ખરીદી

દુકાન અને ઓફિસની ખરીદી

પલાન્ડ અને મશીનરી ખરીદી

મૂડી ખર્ચ

કૃષિ અને આનુષંગિક પ્રવૃત્તિઓ

પશુઓની ખરીદી

વાણિજ્યિક બાંધકામ

અન્ય વ્યવસાય

આવશ્યકતા

G. વર્તમાન લોનની વિગતો

ક્રમાંક નંબર

ખાતા નં.

સંસ્થાનું નામ

ખાતા/સુવિધાનો પ્રકાર

મુદત

ઈએમઆઈની રકમ (રૂપિયામાં)

ફેસિલીટી(સુવિધા)ની રકમ (રૂપિયામાં)

1

2

3

4

5

અરજદારની સહી

એચ. કોલારટલ તરીકે આપવામાં આવેલ મિલકતની વિગતો

ક્રમાંક નં.

પ્રકાર

મિલકતનું નામ

સ્થિતિ

વિસ્તાર

સરનામું

1

2

3

અહીંથી શ્રદ્ધા નાંખો

ફી અને ચાર્જની વિગતો (ગ્રાહકની નકલ)	
1) સ્ટેમ્પ ડ્યુટી લાગુપાત્ર કાયદા અનુસાર વાસ્તવિક.	7) કલેક્શન/ઈએમઆઈ પિક-અપ ચાર્જ: ઘટનાદીઠ રૂ. 600
2) _____% વાર્ષિકના દરે વ્યાજ દર	8) ડુવિડેટ અમોર્ટાઇઝેશન / પુનઃચૂકવણી સમયપત્રક: ઘટનાદીઠ રૂ. 500
3) લાગુ હોય તો પ્રોસેસિંગ ચાર્જ/નોન-રીફંડેબલ રૂ. _____	9) ચેક/એસઆઈ/ઈસીએસ વિનિમય ચાર્જ: ઘટનાદીઠ રૂ. 1000
4) ચેક/એસઆઈ/એનએસીએચ રીટર્ન ચાર્જ: ઘટનાદીઠ રૂ. 500	10) લોન પૂર્વ-ચૂકવણી ચાર્જ: <= ઈએમઆઈ પુનઃચૂકવણીના 12 મહિના: 5% (બાકી મુદ્દલ પર) > ઈએમઆઈ પુનઃચૂકવણીના 12 મહિના: 4%
5) ઓવરડ્રુ હપ્તા પર વ્યાજ: વ્યાજના કરાર દરે (લોન આઈઆરઆર)	11) એકઉન્ટનું સ્ટેટમેન્ટ /ફોરક્લોઝર સ્ટેટમેન્ટ: સ્ટેટમેન્ટ દીઠ રૂ. 500/-
6) હપ્તાના ડિફોલ્ટ પર પેનલ ચાર્જ: પ્રત્યેક રૂ. 1000 દીઠ રૂ. 0.65 (અથવા ત્યારબાદ દરેક હિસ્સા પર) ઓવરડ્રુ હપ્તા પર પ્રતિ દિવસ ચાર્જ કરવામાં આવશે	

નોંધ: (1) જુઓ <http://www.aubank.in> સંબંધિત લોન ઉત્પાદન અંતર્ગત ફી અને ચાર્જની વિગતવાર માહિતી માટે. ચાર્જમાં સમયે સમયે થતા બદલાવ બેંકની વેબસાઈટ પર અપડેટ કરવામાં આવ્યા છે. (2) ઉપરોક્ત તમામ ચાર્જ બેંકની મુનસફી અનુસાર સમયે સમયે બદલાવને આધીન છે. (3) ઉપરોક્ત તમામ ચાર્જ તમામ વૈધાનિક અને સરકારી ટેક્સ સિવાયના છે.

ક્રોલેગ્રાફ (તીરછી સહી કરવેલ)	ઓળખનો પુરાવો	સરનામાનો પુરાવો	નિવાસી ઓફિસ	લોન કરાર	6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ	એસએસઆઈ/ એમએસએમઈ રજીસ્ટ્રેશન	સુરક્ષા પાછલી તારીખના ચેક (પોસ્ટ ડેડેડ ચેક)	સહીની ખરાઈ
ટર્ન ઓવરનો પુરાવો (તાજેતરનું સેલ્સ/સર્વિસ ટેક્સ રીટર્ન)		ગણતરી કરેલ આવક સાથે છેલ્લાં 2 વર્ષનું આઈટીઆર		એનએસીએચ/એસઆઈ મેન્ડેટ(આદેશ)		પાછલી તારીખના ચેક (પોસ્ટ ડેડેડ ચેક)	ઈન્કમ એસેસમેન્ટ વર્કિંગ શીટ	કૃષિ જમીનના દસ્તાવેજ
કરારની/વર્ક ઓર્ડરની નકલ	પુનઃ ચૂકવણી ટ્રેક રેકૉર્ડ	બેલેન્સ ટ્રાન્સફર/બેલેન્સ ટ્રાન્સફર અને ટૉપ અપ માટે લોન એકાઉન્ટ સ્ટેટમેન્ટ.				ભાડા કરાર (જો રહેણાંક અને વ્યવસાય માટે લાગુપાત્ર હોય તો)		
કાર્યકારી ભંડોળની મર્યાદાના કિસ્સામાં આગામી બે વર્ષ માટે અને ટર્મ લોનના કિસ્સામાં લોનના ગાળા માટે અનુમાનિત બેલેન્સ શીટ						ભાગીદારી પેઢી માટે – તાજેતરનો ભાગીદારી ખત, પેઢીનો પાન નંબર અને ઓફિસના સરનામાનો પુરાવો.		
એડવાન્સના ટેક ઓવરની કિસ્સામાં, લેવામાં આવેલ સુવિધાઓના મંજૂરી પત્રો જે વર્તમાન બેંકર/નાણાંકીય						કંપની માટે – સંસ્થાપનના પ્રમાણપત્રો, એમઓએ અને એચઓએ, પાન નંબર, શેરધારણની ઢબ અને ઓફિસ સરનામાનો પુરાવો.		
સંસ્થાનો પાસેથી વિગતવાર નિયમો અને શરતો સાથે લેવામાં આવી છે.						ભાગીદાર/ડિરેક્ટરોની વેપાર અને વ્યક્તિગત એમ બંને આવકની ગણતરી સાથે છેલ્લાં 2-3 વર્ષનું આઈટી રીટર્ન.		
પ્રાથમિક અને ક્રોલેટરલ સિક્યોરિટી તરીકે અપવામાં આવેલ તમામ મિલકતોના ભાડા ખત/ટાઇટલ ડીડની નકલો.						અન્ય કોઈ જરૂર મુજબના દસ્તાવેજ.		
ફરજીયાત લાઈસન્સ/રજીસ્ટ્રેશન/વાયક્રાત વગેરેના સંદર્ભમાં ઉદ્યોગ/ક્ષેત્ર સંબંધિત દસ્તાવેજો.								

જે. ફી અને ચાજની વિગતો

1) સ્ટેમ્પ ડ્યુટી લાગુપાત્ર કાયદા અનુસાર વાસ્તવિક.	7) કલેક્શન/ઈએમઆઈ પિકઅપ ચાર્જઃ ધતનાદી6 રૂ. 600
2) _____% વાર્ષિકના દરે વ્યાજ દર	8) ડુપ્લિકેટ અમોર્ટાઇઝેશન / પુનઃચૂકવણી સમયપત્રકઃ ધતનાદી6 રૂ. 500
3) લાગુ હોય તો પ્રોસેસિંગ ચાર્જ(નોન-રીફંડેબલ) રૂ. _____	9) ચેકબેસઆઈ/ઈસીએસ વિનિમય ચાર્જઃ ધતનાદી6 રૂ. 1000
4) ચેક/એસઆઈ/એનએસીએચ રીટર્ન ચાર્જઃ ધતનાદી6 રૂ. 500	10) લોન પૂર્વ-ચૂકવણી ચાર્જઃ <= ઈએમઆઈ પુનઃચૂકવણીના 12 મહિનાઃ 5% (બાકી મુદત પર) > ઈએમઆઈ પુનઃચૂકવણીના 12 મહિનાઃ 4%
5) ઓવરડ્રગ્ હપ્તા પર વ્યાજઃ વ્યાજના કરાર દરે (લોન આઈઆરઆર)	11) એકાઉન્ટનું સ્ટેટમેન્ટ /ક્લેરકલોઝર સ્ટેટમેન્ટઃ સ્ટેટમેન્ટ દીઠ રૂ. 500/-
6) હપ્તના ડિફોલ્ટ પર પેનલ ચાર્જઃ પ્રત્યેક રૂ. 1000 દીઠ રૂ. 0.65 (અથવા ત્યારબાદ દરેક હિસ્સા પર)	

નોંધ: (1) જુઓ <http://www.aubank.in> સંબંધિત લોન ઉત્પાદન અંતર્ગત ફી અને ચાર્જની વિગતવાર માહિતી માટે.

ચાર્જમાં સમયે સમયે થતા બદલાવ બેંકની વેબસાઈટ પર અપડેટ કરવામાં આવ્યા છે. (2) ઉપરોક્ત તમામ ચાર્જ બેંકની મુનસફી અનુસાર સમયે સમયે બદલાવને આધીન છે. (3) ઉપરોક્ત તમામ ચાર્જ તમામ વૈધાનિક અને સરકારી ટેક્સ સિવાયના છે.

1. હું/અમે પુષ્ટિ કરીએ છીએ કે અરજી ક્ષેત્રમાં આપવામાં આવેલી તમામ વિગતો અને માહિતી સાચી, સાચી અને સંપૂર્ણ છે અને RBL બેંક લિમિટેડથી ("RBL બેંક") કોઈપણ પ્રકારની માહિતીને છુપાવવામાં/દબાવવામાં નથી આવી.
 2. મારા/અમારા દ્વારા મંજૂર કરવામાં આવે છે કે બાકી લેણાં કે નણાણીની રીકવરી માટે અથવા મારી/અમારી મિલકતો અને/અથવા સંપત્તિના જોડાણ માટે કોઈ નાદારી કાર્યવાહી કે દાવો અને/અથવા કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી અને/અથવા મારી/અમારી સંપત્તિને સમેટી લેવા, વિસર્જન કરવા અથવા પુનઃસંગઠન અથવા નિમણૂક કરવા માટે કોઈ કોર્ટ કે અન્ય સત્તાઓ દ્વારા મને/અમને નાદાર ઘોષિત કરવામાં આવ્યા નથી.
 3. મારા દ્વારા અથવા અમારી વિરૂદ્ધ કાયદાની કોઈપણ અદાલતમાં/અન્ય સત્તાધિકારીઓને રીસીવર, એડમિનિસ્ટ્રેટર, એડમિનિસ્ટ્રેટિવ રીસીવર, ટ્રસ્ટી અથવા સમાન અધિકારી અથવા અમારી સંપત્તિને સમેટી લેવા, વિસર્જન કરવા અથવા પુનઃસંગઠન અથવા નિમણૂક કરવા માટે કોઈ પગલાં અથવા અન્ય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
 4. મારા/અમારા દ્વારા સમજાવવામાં અને સ્વીકૃત કરવામાં આવે છે કે એચુ સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડ, કોઈપણ કારણ આપ્યા વગર (કાયદા દ્વારા જરૂરી હોય તે સિવાય), મારી/અમારી અરજી નામંજૂર કરવાની સંપૂર્ણ મુનસ્ફી ધરાવે છે અને આવી નામંજૂરી અથવા આવી નામંજૂરી વિશે મને/અમને જાણ કરવામાં થયેલ વિલંબ, કોઈ ખર્ચ, નુકસાન, ક્ષતિ અથવા કિંમત અથવા આવી નામંજૂરીને કારણે થયેલ અન્ય પરિણામ, અથવા મારી/અમારી અરજીના આવી નામંજૂરી વિશે મને/અમને જણાવવામાં થયેલ કોઈ વિલંબ માટે એચુ સ્મોલ ફાયનાન્સ બેંક કોઈપણ રીતે ન્યાયબદ્ધ ગણાશે નહીં.
 5. એચુ સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડ, તેની યુગ કંપનીઓ જમા કરવામાં આવેલ ક્લોઝાઇડ અને દસ્તાવેજો જાળવવાનો અને તેને અરજદારને પરત ન કરવાનો અધિકાર ધરાવે છે.
 6. હું/અમે એચુ સ્મોલ ફાયનાન્સ બેંકના ડિરેક્ટર(ડિરેક્ટરો) નથી અને કરજદાર કે તેની સબસિડીયરી અથવા તેની હોલ્ડિંગ કંપનીના નોંધપાત્ર હિતના ડિરેક્ટર(ડિરેક્ટરો)/ભાગીદાર(ભાગીદારો), મેનેજીંગ એજન્ટ(એજન્ટો), કર્મચારી(ઓ) અથવા ગેરંટર(ગેરંટરો) અથવા હેલ્ડર(હેલ્ડરો) નથી. જો હા હોય તો, નિયત કરો
 7. હું/અમે અન્ય કોઈ બેંક અથવા અન્ય કોઈ બેંકની સબસિડીયરી, બેંક દ્વારા સ્થાપિત મ્યુચ્યુઅલ ફંડ/વેન્ચર કેપિટલ ફંડના ટ્રસ્ટી નથી અને કરજદારના નોંધપાત્ર હિતના ડિરેક્ટર(ડિરેક્ટરો)/ભાગીદાર(ભાગીદારો), મેનેજર(મેનેજરો), મેનેજીંગ એજન્ટ(એજન્ટો), કર્મચારી(ઓ) અથવા ગેરંટર(ગેરંટરો) કે હેલ્ડર(હેલ્ડરો) નથી. જો હા હોય તો, નિયત કરો
 8. હું/અમે એચુ સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડના ડિરેક્ટર સાથે કે અન્ય કોઈ બેંકના ડિરેક્ટર સાથે, આરબીઆઈ દ્વારા સમયે સમયે વ્યાખ્યાયિત સંબંધમાં માર્ગદર્શિકાઓ અનુસાર જોડાયેલ નથી અને કરજદારની હોલ્ડિંગ કે સબસિડીયરી કંપનીના ડિરેક્ટર(ડિરેક્ટરો)/ભાગીદાર(ભાગીદારો) અથવા મહત્વપૂર્ણ શેરધારક(ધારકો) અથવા કરજદારના નિયંત્રણમાં નથી, જો હા હોય તો, નિયત કરો
 9. મારા/અમારા દ્વારા વધુ મંજૂર કરવામાં અને પુષ્ટિ કરવામાં આવે છે કે સુવિધાની રકમના ડિસ્બર્સમેન્ટ સમયે વિદ્યા સાથે સંબંધિત મંજૂરી પત્ર/ક્રેડેટ્સ અને/અથવા અન્ય કોઈ દસ્તાવેજમાં સ્પષ્ટપણે દર્શાવેલ ચાર્જ, સુવિધાની રકમમાંથી સીધા જ બાદ કરવાનો(ડિસ્બર્સમેન્ટ પહેલાં મારા/અમારા દ્વારા તે યુકલવામાં ના આવ્યા હોય તે ડિસ્ક્વામ) એચુ સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડ અધિકાર ધરાવે છે. એચુ સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડ મને/અમને અથવા મારા/અમારા વતી કોઈ ત્રીજા પક્ષને, જે પણ હોય તે, બાકીની સુવિધાની રકમ ડિસ્બર્સ કરશે અને મંજૂરી પત્રમાં નિયત કરવામાં આવેલ વ્યાજ સાથે અને નિર્ધારિત તારીખ/ગાળામાં અને જ્યારે તે યુકલવાપાત્ર હોય ત્યારે સુવિધાની સંપૂર્ણ રકમ પુનઃયુકલવા માટે હું/અમે જવાબદાર રહીશ/રહીશું.
 10. મે/અમે મારા માટે અરજી કરી છે તે ઉત્પાદનની લાક્ષણિકતાઓ વિશે મને/અમને સમગ્રતી આપવામાં આવી છે. એચુ સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડના લોભ ઉત્પાદનના નિયમો અને શરતો મે/અમે વાંચ્યા અને સમજ્યા છે અને હું/અમે તેનો પાલન કરવા માટે સંમત છું/છીએ. જો મારા/અમારા દ્વારા અરજી કરવામાં આવેલ સુવિધા મંજૂર થઈ હોય અને મારી/અમારી અરજીના અધિકાર એચુ સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડ દ્વારા તે માન્ય કરવામાં આવી હોય તો ફેસિલિટી વ્યાખ્યામાં આપેલ તમામ નિયમો અને શરતો ફેસિલિટીનું અને તેના સંબંધમાં મારી/અમારી તમામ જવાબદારીઓનું(તેમ જ એચુ સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડના અધિકારો અને ઉપાયો) તે નિયમન કરે છે અને લાગુ પાત્ર રહેશે.
 11. મારા/અમારા દ્વારા આ સાથે એચુ સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડ, અને તેના ચેસોસિયેટ્સ/સબસિડીયરી/સહયોગીઓને મારી ઓફિસ/ધરની મુલાકાત લઈને અને/અથવા મારા અને/અથવા મારા પરિવારના સભ્યો અને/અથવા નિયોક્તા/બેંકર/કેડિટ બ્યુરોના સંપર્ક દ્વારા કોઈપણ જાણકારીની ખરાઈ કરવાની અને મારા તમામ જમા કરાવેલ દસ્તાવેજો અને એચુ સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડની નીતિઓ સાથે સંબંધિત અન્ય જાણકારી માટે આંતરિક ચકાસણી હાથ ધરવાની અધિકૃતતા આપવામાં આવે છે અને કોઈ વિરોધ દર્શાવવામાં આવતો નથી. મારા/અમારા દ્વારા એચુ સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડને આરઓસી સર્ચ હાથ ધરવા માટે અને મારા/અમારા દ્વારા લેવામાં આવેલ સુવિધાઓ સામે ચાર્જ ધરાવવા માટે અધિકૃતતા આપવામાં આવી છે.
 12. મારા/અમારા દ્વારા આ સાથે એચુ સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડ, અને તેના ચેસોસિયેટ્સ/સબસિડીયરી/સહયોગીઓને મારી ઓફિસ/ધરની મુલાકાત લઈને અને/અથવા મારા અને/અથવા મારા પરિવારના સભ્યો અને/અથવા નિયોક્તા/બેંકર/કેડિટ બ્યુરોના સંપર્ક દ્વારા કોઈપણ જાણકારીની ખરાઈ કરવાની અને મારા તમામ જમા કરાવેલ દસ્તાવેજો અને એચુ સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડની નીતિઓ સાથે સંબંધિત અન્ય જાણકારી માટે આંતરિક ચકાસણી હાથ ધરવાની અધિકૃતતા આપવામાં આવે છે અને કોઈ વિરોધ દર્શાવવામાં આવતો નથી. મારા/અમારા દ્વારા એચુ સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડને આરઓસી સર્ચ હાથ ધરવા માટે અને મારા/અમારા દ્વારા લેવામાં આવેલ સુવિધાઓ સામે ચાર્જ ધરાવવા માટે અધિકૃતતા આપવામાં આવે છે.
 13. અહીં ઉપર જણાવેલ મારા/અમારા મારા/અમારા સરનામા, ઈ-મેઈલ આઈડી, સંપર્ક નંબરમાં કોઈપણ ફેરફારના સંબંધમાં એચુ સ્મોલ ફાયનાન્સ બેંકને જાણ કરવાની મારા/અમારા દ્વારા બાંધધરી આપવામાં આવે છે.
 14. મારા/અમારા દ્વારા પુષ્ટિ કરવામાં આવે છે અને સ્વીકારવામાં આવે છે કે મને/અમને એચુ સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડ દ્વારા સુવિધાની મંજૂરી મારા/અમારા દ્વારા આ અરજી ક્ષેત્ર, મંજૂરી ન હોય તેના સમયપત્રક/સંયુક્ત રીતે, "સુવિધાની શરતો"માં નિયત કરેલ નિયમો અને શરતોના પાલનને અર્પીત છે.
 15. મારા/અમારા દ્વારા વધુ મંજૂર કરવામાં અને પુષ્ટિ કરવામાં આવે છે કે સુવિધાની રકમના ડિસ્બર્સમેન્ટ સમયે વિદ્યા સાથે સંબંધિત મંજૂરી પત્ર/ક્રેડેટ્સ અને/અથવા અન્ય કોઈ દસ્તાવેજમાં સ્પષ્ટપણે દર્શાવેલ ચાર્જ, સુવિધાની રકમમાંથી સીધા જ બાદ કરવાનો(ડિસ્બર્સમેન્ટ પહેલાં મારા/અમારા દ્વારા તે યુકલવામાં ના આવ્યા હોય તે ડિસ્ક્વામ) એચુ સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડ અધિકાર ધરાવે છે. એચુ સ્મોલ ફાયનાન્સ બેંક લિમિટેડ મને/અમને અથવા મારા/અમારા વતી કોઈ ત્રીજા પક્ષને, જે પણ હોય તે, બાકીની સુવિધાની રકમ ડિસ્બર્સ કરશે અને મંજૂરી પત્રમાં નિયત કરવામાં આવેલ વ્યાજ સાથે અને નિર્ધારિત તારીખ/ગાળામાં અને જ્યારે તે યુકલવાપાત્ર હોય ત્યારે સુવિધાની સંપૂર્ણ રકમ પુનઃયુક

નિયમો અને શરતો: આધાર

આથી હું/અમે એવુ સ્મોલ કાઉન્સિલ બેંક લિ.ને યુઆઈડીએઆઈની સીધી પ્રમાણીકરણ કરવા માટે મારો આધાર નંબર, નામ અને આંગળીઓની છાપ મેળવવા / આંખની કીકીનું સ્કેન કરવા મારી/અમારી સંમતિ આપું છું/આપીએ છીએ. બેંકે મને જણાવ્યું છે કે, મારી ઓળખની વિગતોની ઉપયોગ ફક્ત કેવાયસી માટે થશે અને મને એ પણ જણાવવામાં આવ્યું છે કે, મારા બાયોમેટ્રિક્સને સંગ્રહિત કરવામાં આવશે નહીં/શેર કરવામાં આવશે નહીં તથા તેને પ્રમાણીકરણના હેતુ માટે જ સીઆઈડીઆરને સોંપવામાં આવશે.

મારા વોટસએપ મોબાઇલ/વૈકલ્પિક મોબાઇલ નં..... પર મારા બેંક ખાતા, લોન, ઈન્સ્યોરન્સ અને અન્ય ઉત્પાદનો માટે પ્રચારાત્મક અભિયાન, અને મહત્વપૂર્ણ જાણકારી અને અપડેટ્સ માટે સબસ્ક્રાઇબ કરવાની માટે અને બેંક તરફથી કોમ્યુનિકેશન મેળવવાની હં મંજૂરી આપું છું

અરજદારની સહી	અરજદારની સહી	સહ-અરજદાર/ગેરંટરની સહી
--------------	--------------	------------------------

ફક્ત બેંકના આંતરિક ઉપયોગ માટે

મારા દ્વારા પુષ્ટિ કરવામાં આવે છે કે અરજી ફોર્મમાં દર્શાવેલ અરજદાર(અરજદારો)ના સરનામા(ઓ)ની મે મુલાકાત લીધી છે અને અરજદાર/સહ-અરજદાર/ગેરંટર દ્વારા મારી હાજરીમાં સહી કરવામાં આવી છે

બીએસએમ/એબીએમ/બીએમની સહી	તારીખ સાથે આરપીસી/સીપીસી સિક્કો	આરસીયુ સહી અને તારીખ
-------------------------	---------------------------------	----------------------

અરજી આઈડી: _____ અરજી નં.: _____

અમે સ્વીકૃત કરીએ છીએ કે અમને _____ તારીખે _____ ના નિવાસી/સ્થિત શ્રી/કુમારી/શ્રીમતી _____

તરફથી _____ અંતર્ગત ગ્રા. _____ ની લોન માટેની અરજી પ્રાપ્ત થઈ છે અને મંજૂરી અથવા નામંજૂરી વિશેનો નિર્ણય આ અરજી અને અન્ય તમામ સંબંધિત વિગતો બેંકને મળ્યાની તારીખથી 30 દિવસોની ની અંદર જણાવવામાં આવશે.

(*૩. 25 લાખ સુધીની લોનની રકમ ધરાવતા સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે 14 ક્રમશઃક્રમ દિવસોની અંદર.)

એયુ સ્મોલ ફાયનાન્સ બેંક લિ.

કપા કરીને નોંધો કે:

1. આ કક્ષત અરજી મળ્યાની પછિ છે અને તેને અમારા દ્વારા દરખાસ્ત સ્વીકાર થયાનો સંકેત ગણ

કરવામાં આવેલ, જો કોઈ શરતો હોય તે તેની પૂર્તિ પર યોગ્ય વિચારણા કર્યા બાદ જ લેવામાં આવશે.

2. બેંક દ્વારા જરૂરી તમામ વિગતો/તારીખ/દસ્તાવેજ મળ્યા બાદ જ અરજીને ધ્યાનમાં લેવામાં આવશે.

3. જા દરખાસ્ત નામજી
દોષિયાણા પાલિકામથના દિ.

ગ્રાહકો પાસેથી મૂલ્યવટીઓની કિસ્સામાં, તમારું CustomerCare@adbank.in પર અથવા ઇ-મેઇલ કરી રાજી ઓ, અથવા બાલ ફાઇનલ પર કાલ કરી રાજી ઓ કે ઓ. **1800 1200 1200**
